

ત્વરિત જાહેરાત માટે

કોવિડન કોન્ફરન્સ ખાતે સિટી બ્રેમ્પટનને 35,000 કરતા વધુ આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકગણ સામે પ્રદર્શિત કરશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (30 જૂન 2022) – ગત સપ્તાહમાં સિટી ઓફ બ્રેમ્પટનને બ્રેમ્પટન સહેરને બે વર્ષમાં થયેલ સૌથી વિશાળ ઈન-પર્સન ટેક મેળાવડામાં પ્રદર્શિત કર્યું હતું જે ટોરોન્ટોમાં હાથ ધરાયેલ કોવિડન કોન્ફરન્સમાં 130 કરતા વધુ દેશોના 35,000 કરતા વધુ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપ્સથી ખચોખચ ભરેલી કોન્ફરન્સમાં પ્રદર્શિત કર્યું હતું.

ત્રણ દિવસમાં બ્રેમ્પટનનો બૂથ હજારો મુલાકાતીઓ આકર્ષી શક્યો હતો જેમાં સરકારના મંત્રીઓ અને રમતગમત તેમજ મિડિયાના જાણીતા લોકોનો સમાવેશ થાય છે. તેમાં બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર, બીહાઈવ બ્રેમ્પટન (BHive Brampton), અલ્ટિટ્યુડ એક્સલેરેટર, ટ ફાઉન્ડર્સ ઈન્સ્ટિટ્યુટ, અલ્ગોમા યુનિવર્સિટી, શેરિડાન કોલેજ, રોજર્સ સાયબરસિક્યોર કેટેલિસ્ટ, બ્રેમ્પટન વેન્યર ઝોન અને વિશેષ અતિથિ બ્રેમ્પટન બેટમેન સહિત ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ અને તેના સહયોગીઓનો પરિચય કરાવવામાં આવ્યો.

સ્ટાર્ટ-અપ્સ, ઉદ્યમીઓ અને સમુદાય માટે મજબૂત ઈકો સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે બ્રેમ્પટન ઈકોનોમિક ડિવલપમેન્ટ એ ઉચ્ચ ગુણવત્તાના વિડ્સ ઊભા કરવા, હાલના કોર્પોરેટ સંબંધોને મજબૂત કરવા અને સિટીની બ્રાન્ડને ઈનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યમના ક્ષેત્રોમાં જાણીતી કરવા માટે કાર્ય કર્યું. બ્રેમ્પટનની ટીમે સેક્ટોર કેનેડિયન અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ્સ, વેંચર કેપિટલ ફંડો, એન્જલ્સ અને રોકાણકારો સાથે પરિચય વધાર્યો અને તેમને બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટની મુલાકાત લેવા નિમંત્રણ આપ્યું – જેમાંથી અનેક લોકોએ ઉપલબ્ધ છે તે વર્લ્ડ ક્લાસ પ્રોગ્રામિંગમાં જોડાવા રસ દાખવ્યો હતો.

વિવિધતા, સમાનતા અને સમાવેશીતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે બ્રેમ્પટન ઈકોનોમિક ડિવલપમેન્ટ એ કોવિડન કોન્ફરન્સના આયોજકો સાતહે કાર્ય કર્યું જેમણે 362 અશ્વેત ઉદ્યમીઓ અને બ્રેમ્પટનના યુવાનોના પ્રતિનિધિમંડળ માટે નિશુલ્ક ટિકિટોની વ્યવસ્થા કરી હતી જેથી તેઓ કોવિડન કોન્ફરન્સમાં હાજરી આપી સહભાગી થઈ શકે અને તેનો લાભ લઈ શકે. સિટીએ બિલ્ડ બ્લેક ફેનેડાના નેટવર્કિંગ પ્રયાસોને પણ સમર્થન આપ્યું અને સશક્તિકરણના આશયથી કોવિડન કોન્ફરન્સમાં હાજર રહેલા યુવા અશ્વેત ઉદ્યમીઓ અને વ્યવસાયિકો માટેના સત્કાર સમારંભમાં મદદરૂપ થયા.

સિટી એક માત્ર નગરપાલિકા બની જેમણે કોવિડન પ્રોગ્રામમાં ક્યુરેટ કરેલ આફ્રિકા દિનમાં ભાગ લીધો – જે પ્રસંગનું આયોજન BKR કેપિટલ, ટેક્સ્ટાર્સ, અને ડ્રીમ લિગસી ફાઉન્ડેશને કર્યું જેમણે કોવિડનમાં ઉચ્ચ કોટીના આફ્રિકન સ્ટાર્ટ અપ્સનો પરિચય કરાવ્યો.

બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટના 15 કરતા વધુ સ્ટાર્ટ-અપ્સને પોતાની વિભાવનાઓ પ્રસ્તુત કરવાનો અવસર પ્રાપ્ત થયો અને તેને કોન્ફરન્સમાં પોતાના બૂથમાં પ્રદર્શિત થઈ શક્યું. બ્રેમ્પટન બૂથે બ્રેમ્પટન ટેલન્ટ ડિવલપમેન્ટ પાર્ટપલાઈન એગ્જિબિટનું પણ આયોજન કર્યું જેમાં જોવા મળ્યું શેરિડાન કોલેજના સેન્ટર ફોર એડવાન્સ્ડ મેન્યુફેક્ચરીંગ એન્ડ ડિઝાઈન ટેકનોલોજીના નેજા હેઠળ રોબોટિક્સનું નિદર્શન થયું અને સાથે જ અલ્ગોમા યુનિવર્સિટીના નવા ઈસ્પોર્ટ્સ પ્રોગ્રામ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો.

કોલિઝન વિષયક

કોલિઝન ઉત્તર અમેરિકામાં સૌથી ઝડપી વિકાસ પામતી ટેક કોન્ફરન્સ છે જ્યાં, ટોચના વક્તાઓ", ટેકની અગ્રેસર કંપનીઓ અને ટોચના મિડિયા એક જ સ્થળે ભેગા થશે. સિટી ઓફ બ્રેમ્પટનની આર્થિક વિકાસની કચેરીની ટીમે આ વૈશ્વિક ઇવેન્ટમાં ચોથી વખત ભાગ લીધો જેમાં તેમની સાથે હતા બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ સહયોગીઓ અને વિશેષ અતિથિ બ્રેમ્પટન બેટમેન

બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિષયક

સિટી ઓફ બ્રેમ્પટન ઈનોવેશન અને ઉદ્યોગસાહસિક ઈકોસિસ્ટમ બનાવીને તેમના ડાઉનટાઉનની આર્થિક સંભાવનાને પુનર્જીવિત કરીને તેને ફરી ખુલ્લી કરવાનું ચાલુ રાખે છે: બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનું ધ્યાન સ્ટાર્ટ અપ વિકાસ, નિવેશને આકર્ષવા પર અને પ્રતિભાઓને ખીલવવા પર કેન્દ્રિત છે અને તે સાહસિકો અને નવા વ્યવસાયોને સ્થાનિક સમર્થન પ્રદાન કરે છે. તે ઈનોવેશન અને ટેકનોલોજીની કંપનીઓને નવી ટેકનોલોજીના સર્જનમાં આગળના ચરણ પર લઈ જવા માટે સંસાધનો પૂરા પાડે છે. 2019થી કરાર બનવાના શરૂ થયા તે અત્યાર સુધીમાં સિટીએ તેના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં \$20.5 મિલિયન જેટલી માતબર રકમ રોકવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે ઉપરાંત ઈનોવેશન ભાગીદારો પાસેથી આશરે \$55.2 મિલિયન જેટલું રોકાણ થઈ રહ્યું છે.

સિટીના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિશે વધુ જાણકારી મેળવવા માટે, અહીં મુલાકાત લો www.bramptoninnovationdistrict.com અથવા સિટીનો ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડિયો જુઓ.

સુવાક્યો

કોલિઝન વિશ્વની ટોચની તકનીકી કોન્ફરન્સો પૈકી એક છે, જે લોકોને, મહાન વિભાવનાઓ અને વિશ્વની અગ્રણી કંપનીઓને એકસાથે લાવે છે. બ્રેમ્પટન કેમ રોકાણ કરવા માટેનું ઉત્તમ સ્થળ છે તેના પર ભાર મુકવા માટે ગયા અઠવાડિયે મને આપણી ઈકોનોમિક ડિવલપમેન્ટની ટીમ સાથે જોડાવાનું ગૌરવ મળ્યું. આપણું શહેર એક રોમાંચક પરિવર્તનની મધ્યમાં છે અને આપણા ભાગીદારોની સાથે મળીને આપણા ઈનોવેશન ડિસ્ટ્રિક્ટને આપણે એક મુખ્ય શૈક્ષણિક અને ઈનોવેશનનું કેન્દ્ર બનાવી રહ્યા છીએ.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન ઉદ્યોગસાહસિકો માટે અવિશ્વસનીય સંસાધનો સાથેના અવસરોનું શહેર છે જ્યાં સ્ટાર્ટ-અપ્સ વિકસી શકે, અને અમારા સહયોગીઓ સાથે, અમે અમારા રહેવાસીઓ અને વ્યવસાયોને લાભ આપવા માટે ઈનોવેશન ઈકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. ગયા અઠવાડિયે કોલિઝનમાં

બ્રમ્પટનને 35,000 ના વૈશ્વિક પ્રેક્ષકો સામે પ્રસ્તુત કરવા બદલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ટીમનો આભાર. બ્રમ્પટન વ્યાપાર અંગે ગંભીર છે અને અમે અમારા સમુદાયોમાં અગ્રેસર હોય એવી વૈશ્વિક કંપનીઓને આકર્ષતા રહેવા ઉત્સુક છીએ."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4; પ્રમુખ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રમ્પટન.

"બ્રમ્પટન આર્થિક વિકાસની કચેરી આપણા સમસ્ત સમાજને લાભ મળે તે આશયથી આપણા શહેરને એક શિક્ષણ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવીને માર્ગ ચીંધી રહ્યા છે. બ્રમ્પટનની તાકાતનો પરિચય ગયા અઠવાડિયે વૈશ્વિક પ્રેક્ષકો સામે કોલિઝન કોન્ફરન્સમાં કરાવા બદલ આપણી ટીમને ધન્યવાદ. અમે બ્રમ્પટનને રોકાણ કરવાનું અને ઇનોવેશન કોરિડોરમાં બ્રમ્પટનની અનન્ય સ્થિતિને મજબૂત કરવાનું ઉત્તમ સ્થળ બનાવવા અમે સમર્પિત છીએ.

- ક્લેર બાર્નેટ, ડાયરેક્ટર, બ્રમ્પટન ઇકોનોમિક ડેવલપમેન્ટ, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca